

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ક્રમાંક : મહિને/૧૦૨૦૨૩/૨૧૪/૫

સચિવાલય, ગાંધીનગર.

તારીખ:- ૨૭ FEB 2023

**વિષય :** ૧૯૬૦ના ગુજરાત સરકારના કામકાજના નિયમોના નિયમ-૧૫ હેઠળ બધાર પાડવામાં આવેલ સૂચનાઓની સૂચના ૪(૧)(ક) અનુયાયે જુદી જુદી કક્ષાના અધિકારીઓની સત્તાનુકૂળ કરવા અંગે.

**નિરાય :**

ગુજરાત સરકારના કામકાજના નિયમોના નિયમ-૧૫ હેઠળ બધાર પાડવામાં આવેલ સૂચનાઓની સૂચના નં.૪(૧)(ક) અનુસાર સદરહુ નિયમોની પહેલી અનુસૂચિના લાગ્ન-૨ માં ગૃહ વિભાગને ફાળવેલ ક્રમ-૧ થી ૩૮ આગામી દર્શાવેલ વિષયો પૈકી નશાબંધી અને આબકારીને લગતા વિષયોના કેસોનો આ હુકમ સાથે જોડેલ પરિશીષ્ટ-૧, ૨ અને ૩ માં દર્શાવેલ કક્ષાએ નિકાલું કરવાનો આદેશ આપું છું.

આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ, કાયદા વિભાગ તથા અન્ય સંબંધિત વહીવટી વિભાગની સંખાયી સૂચનાઓ કે તેમાં વખતો વખત થતા ફેરફારને ધ્યાને લઈને, તે મુજબ રજૂઆતનો રાહ રાખીને યોગ્ય કક્ષાએ નિર્ણય લેવાની બાબત સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના સચિવ/અગ્ર સચિવ/અધિક મુખ્ય સચિવની રહેશે.

(ભૂજી પટેલ)

માન.મુખ્ય મંત્રી

**નકલ રવાના :**

- પરમ સન્માનનીય રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર (પત્ર દ્વારા).
- માન. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી, સ્વર્ણામિ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
- સચિવશ્રી, કાયદા વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અધિક મુખ્ય સચિવશ્રી (ક.ગ.), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સચિવશ્રી (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- ઉપસચિવશ્રી (કેબીનેટ), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સંબંધિત ખાતાના વડાઓ.
- વિભાગના સર્વે અધિક/સંયુક્ત/નાથબ/ઉપ સચિવશ્રીઓ.
- વિભાગની સર્વે શાખાઓ.
- કાર્યાલય આદેશ ફાઇલ/ સિલેક્ટ ફાઇલ.



# નશાંબંધી અને આબકારીની સત્તા સૌપણી

## પરિચિચનું

નીચેના પૈકી કોઈપણ બાબત અંગે નિર્ણય લેવાનો થતો હોય તો તેવા કેસનો નિકાલ અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી / સચિવશ્રીએ કરવો

૧. જાહેર ફિસાબ સમિતિ, જાહેર ઉપકમ સમિતિ, ગૌણ વિધાન સમિતિ, અંદાજ સમિતિ, ખાતરી સમિતિને તથા વિધાનસભાની અન્ય સમિતિઓને લગતી બાબતો.
૨. લોકસભા / રાજ્યસભાના પ્રશ્નો બાબત.
૩. વિધાનસભાના પ્રશ્નો સચિવાલયના અન્ય વિભાગોને તબદીલ કરવા બાબત.
૪. કેન્દ્ર સરકારના નિતિ વિષયક મહત્વના કાગળો.
૫. ખાતાના વડા તેમજ સચિવાલયના વહીવટી વિભાગના સચિવશ્રીને સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણા વિભાગ તરફથી વખતો વખતની જે તે બાબત અંગે વહીવટી / નાણાકીય સત્તાઓ આપેલી છે તેની બાબતો.
૬. સામાન્ય પ્રકારના ન હોય તેવા પ્રકારના દસ્તાવેજ, કોન્ટ્રાક્ટ્સ અને ખાતરી સરકારવતી આપવા બાબત.
૭. અંદાજપત્રમાં કરવામાં આવેલ ફંડની જોગવાઇમાં પુનઃ વિનિયોગ હુકમો બચતો સુપરત કરવાની બાબતો, સુધારેલ અંદાજો, પુરક માંગણી પત્રકો અને ચાલુ બાબતો વગેરેની દરખાસ્તો.
૮. નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ ફિસાબ અને પંચાયતોના ઓડીટ અહેવાલો જેમાં ગંભીર પ્રકારની અનિયમિતતા કે ગેરરીતિઓ હોય તેવી બાબતો.
૯. એજુ / લોકલ ફંડના ઓડિટ પારા અને તેના પરના ખુલાસા.
૧૦. વહીવટી નિયંત્રણ ફેઠળના અધિકારી કર્મચારીઓને નાણા વિભાગના આદેશો અનુસાર હવાઈ પ્રવાસની મંજુરી આપવા બાબત.
૧૧. નાણા વિભાગ / સામાન્ય વહીવટ વિભાગની સ્થાયી સૂચનાઓ અનુસાર રાજ્યપંત્રિત / બિનરાજ્યપત્રિત અધિકારી કર્મચારીઓને ઉચ્યતર પગાર ધોરણ મંજુર કરવા બાબત.
૧૨. નાણા વિભાગના વખતોવખત બહાર પાડવામાં આવતા જુદા જુદા હુકમોને આધીન રહીને વહીવટી નિયંત્રણ ફેઠળના રહેણાંકના મકાનો સહિત અન્ય મુલકી સેવાના કામોને નકશા અને અંદાજોની વહીવટી મંજુરી.

૧૩. નાણા વિભાગના સ્થાયી હુકમો મુજબ રાજ્યપત્રિત અધિકારીઓના પગાર નક્કી કરવા અંગેની બાબતો.
૧૪. પ્રવર્તમાન નિયમો અધીન રહી વિભાગના નિયંત્રણ ફેઠળની કચેરીઓને કાયમી પેશાગીની (Permanent Advance) રકમને મંજુરી આપવા બાબત.
૧૫. વસુલાત ન થઈ શકે તેવા સ્ટોર, દેવાઓ, જાહેર નાણાની ખોટની રકમની પ્રવર્તમાન નિયમોને અધીન માંડવાળ કરવી.
૧૬. ગુજરાત આકસ્મિક ખર્ચ અંગેના નિયમોની જોગવાઈ મુજબ વાહનો, ટાઇપરાઇટરો, કોમ્પ્યુટર-પ્રિન્ટર, ફિનિચર અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો પુસ્તકો અને સ્ટેશનરી વગેરેની ખરીદી/ તેને રદબાતલ (કન્ડેમ) કરવાની દરખાસ્ત.
૧૭. સરકારી કર્મચારીઓ પાસેથી વસુલાતો અને તે બાબતમાં પ્રવર્તમાન નિયમોને આધીન રહીને માંડવાડ કરવી.
૧૮. સ્થાયી સુયનાઓ અનુસાર ફાજર થવાનો વધુ સમય જાહેર કરવા તેમજ કી, માનદ વેતન અંગેની દરખાસ્તો.
૧૯. અધિલ ભારતીય સેવા/ પોલીસ અધિકારીઓ સિવાયના અન્ય વર્ગ-૧ ના અધિકારીઓને કાયમી કરવાની બાબત.
૨૦. અધિલ ભારતીય સેવા/ પોલીસ અધિકારીઓ કે જોઓના પગાર ધોરણનો અધિકતમ માસિક પગાર રૂ.૧,૭૭,૫૦૦/- અથવા વધુ હોય તે સિવાયના અન્ય અધિકારીઓની પસંદગી યાદીના આધારે અથવા પસંદગી યાદીમાં ન હોય તેવા કિસ્સામાં સૌથી સીનીયર વ્યક્તિની બે મહિના કરતાં ઓછી મુદત માટેની અવેજુ નિમણુંક.
૨૧. ખાતાના વડાઓને સંતા સોપણી અંગે નિયમો કરવા બાબત.
૨૨. વહીવટી નિયંત્રણ ફેઠળના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની પ્રવરતા યાદી નક્કી કરવા બાબત.
૨૩. વહીવટી નિયંત્રણ ફેઠળના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને પેન્શન, કુંટંબ પેન્શન, ભવિષ્ય નિધિમાંથી પેશાગી, વતન પ્રવાસ પેશાગી, મકાન બાંધકામ પેશાગી, વાહન માટે પેશાગી વગેરે મહેકમને લગતી બાબત.
૨૪. ગૃહ વિભાગના વહીવટી નિયંત્રણ ફેઠળના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને મૂળ નિમણૂક વખતે પાંચ અગ્રિમ ઇજાફાઓ સુધીનો ઉચ્ચ પગાર મંજૂર કરવો.

ગૃહ વિભાગના વહીવટી નિયંત્રણ ફેઠળના વર્ગ-૨ના અધિકારીઓમાં જુનીયર અધિકારીને તેનાથી સીનીયર અધિકારીઓની સીનીયોરીટી અવગણીને બે મહીના સુધી અવેજુ નિમણૂકની દરખાસ્ત અન્વયે નિમણૂકની બાબત.

૨૬. ગૃહ વિભાગના વહીવટી નિયંત્રણ ફેઠળની (i) વર્ગ-૧ના મહત્તમ પગાર ધોરણ રૂ.૧,૭૭,૫૦૦/-સુધીની જગ્યાઓ (ii) વર્ગ-૨ (રાજ્યપત્રિત) જગ્યાઓ અને (iii) બિનરાજ્યપત્રિત સંવર્ગની ફંગામી જગ્યાઓ એક વર્ષ માટે ઉભી કરવી.
૨૭. તકેદારી પંચના સંદર્ભો (સામાન્ય અને વહીવટી પ્રકારના સિવાયના)
૨૮. નોકરી દરમાનાં મૃત્યુ પામનાર સરકારી કર્મચારી / અધિકારીના કુંટુંબના સભ્યને રહેમરાહે નોકરી આપવા/ ઉચ્ચક આંશિક સહાય ચુકવવા બાબત.
૨૯. પસંદગી ચાદી ન હોય તેવા કિસ્સામાં ગૃહ વિભાગના વહીવટી નિયંત્રણ ફેઠળના રાજ્યપત્રિત વર્ગ-૨ અધિકારીઓની (બે મહિના કરતાં વધુ મુદત માટેની) અવેજુ નિમણૂક.
૩૦. બિન રાજ્યપત્રિત કર્મચારીઓની ખાતાકીય પંગલાં સામેની અપીલ સહિતની અપીલો.
૩૧. બિન રાજ્યપત્રિત કર્મચારીઓને ફરજમોક્ષફી પર ઉતારવા બાબત.
૩૨. ભરતી નિયમો અને તેનું અંશીધટન.
૩૩. ભરતી નિયમો સાથે સુસંગત રહીને સીધી ભરતીથી પસંદગી માટે રાજ્ય સેવા કમિશનને માંગણીપત્રક મોકલવાની બાબત.
૩૪. રાજ્યપત્રિત અધિકારીઓ / કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો ઘડવા બાબત.
૩૫. રાજ્યપત્રિત અધિકારીઓને કાનુની સહાયના કેસો.
૩૬. રાજ્યપત્રિત અધિકારીઓને પાસપોર્ટ/ વિઝા વગેરે મેળવવા માટે “ના વાંધા પ્રમાણપત્ર” (No Objection Certificate) આપવા બાબત.
૩૭. રાજ્યપત્રિત અધિકારીને ઉચ્ચ અભ્યાસની પરવાનગી આપવા બાબત.
૩૮. વર્ગ-૨ના અધિકારીઓની નાની શિક્ષા કરવાની બાબત.
૩૯. વર્ગ-૨ રાજ્યપત્રિત અધિકારીઓના રાજીનામા અને સ્વૈચ્છક નિવૃત્તિ બાબત.
૪૦. વર્ગ-૨ના અધિકારીઓને ૫૦-૫૫ વર્ષ પછી સેવામાં ચાલુ રાખવાની બાબતો.
૪૧. વહીવટી નિયંત્રણ ફેઠળના રાજ્યપત્રિત વર્ગ-૧, ૨ અધિકારી સામેની પ્રાથમિક તપાસને લગતી બાબતો.

૪૨. વહીવટી નિયંત્રણ વર્ગ-૨ના અધિકારીઓની બદલી માટે પસંદગી ચાદી તૈયાર કરવી.
૪૩. વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓના રાજ્યપત્રિત/ બિનરાજ્યપત્રિત અધિકારીઓ/ કર્મચારીઓને નાણા વિભાગના વખતોવખતના બહાર પડાતા હુકમો/ સૂચનાઓને અધીન રાજ્ય બહાર મુસાફરી કરવાની પરવાનગી આપવી.
૪૪. વ્યવસ્થા અને કાર્યરીતિ તેમજ વહીવટી સુધારણાને લગતી બાબતો.
૪૫. સામાન્ય વહીવટ વિભાગના હુકમોને અધિન વર્ગ-૨ના રાજ્યપત્રિત અધિકારીઓને ભારતની અંદર તાતીમ અને પ્રતિનિયુક્તિથી મોકલવા અંગેની બાબતો.
૪૬. સામાન્ય વહીવટ વિભાગની વખતોવખતની સૂચનાઓ અનુસાર કચેરી અને અધિકારીઓના નિવાસસ્થાનના ટેલીઝોનની મંજૂરી.
૪૭. સ્થાયી સૂચનાઓ અનુસાર અધિકારી/કર્મચારીની જન્મ તારીખમાં ફેરફાર કરવાની હોય તેવી બાબતો.
૪૮. આકસ્મિક લંડોળમાંથી ઉપાડ અંગેની દરમાસ્ત.

## પરિશિષ્ટ - ૨

નીચેના પૈકી હોઇપણ બાબત અંગે નિર્ણય લેવાનો થતો હોય તો તેવા કેસનો

નિકાલ અધિક સચિવશ્રી / સંયુક્ત સચિવશ્રી / નાયબ સચિવશ્રીએ કરવો

૧. અર્ધ ન્યાયિક અપીલ અંગેના કેસો.
૨. ખાતાના અને કચેરીઓના વડાની કચેરીઓના નિરીક્ષણ.
૩. દિવાની દાવા રીટ પીઠીશનો અંગે પારાવાઈજ રીમાર્ક્સ એફીડીટ મંજુર રાખવા બાબત.
૪. નિયમો તથા અન્ય પ્રકાશનો છપાવવા બાબત.
૫. બે વર્ષ પહેલા મોટર/ સ્કુટર વેચવાની પરવાનગી.
૬. ભારત સરકાર અને અન્ય વિભાગોને હકીકતો સાથેની તેમજ સામાન્ય પ્રકારની માહિતી મોકલવા બાબત.
૭. રાજક્ષાની ન હોય તેવી સમિતિની રચના અને પુન: રચના.
૮. સચિવાલયમાં વહીવટી વિભાગોના અધિક/ સંયુક્ત/ નાયબ સચિવશ્રીઓને સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણા વિભાગ તરફથી વહીવટી/નાણાકીય સત્તાઓ આપેલી હોય તે બધી બાબતો.
૯. સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન હુકમો અનુસાર અનામી તથા બીજાઓને નામે અરજીઓની તપાસ અધિકારીઓને સોંપવા બાબત.
૧૦. સેવા અને પગારના નિયમોના અર્થધટન અને નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને મોકલવાના હોય તેવા કેસો.
૧૧. બિનરાજ્યપત્રિત કર્મચારીઓને વાહન પેશાગીની સ્થાયી સૂચનાઓ મુજબની કાર્યવાહી, વર્ગ-૨, ઉના અધિકારી/ કર્મચારીઓને જીપીએફમાંથી પેશાગી, અંશતઃ આખરી ઉપાડ તથા ખાસ કિસ્સા તરીકે પેશાગી ઉપાડ મંજુર કરવાની બાબત.
૧૨. નિયત નિયમો અનુસાર નાણા વિભાગ સાથે પરામર્શ કરી કુંટંબ પેન્શન મંજુર કરવાની દરખાસ્ત.
૧૩. કર્મચારીઓ પાસેથી જામીનગીરી લેવા બાબત.
૧૪. ગ્રાન્ટ ઉપાડવા અને ચુકવણી કરવા માટે અધિકારીઓને કચેરીના વડા તરીકે જાહેર કરવા બાબત.

૧૫. તાબાની કચેરીઓના ટેલીફોન ખર્ચ મંજૂર કરવા બાબત.
૧૬. સરકારી વાહનો તથા કોમ્પ્યુટર, એરોક્ષ મશીન અને અન્ય સાધનોની મરામત અને જાળવણી અંગે રૂ.૫૦ હજાર સુધીનું આવર્તક ખર્ચ અને અનાવર્તક ખર્ચની મંજૂરી.
૧૭. નાણા વિભાગના હુકમો અનુસાર આવર્તક ખર્ચની રૂ.૨૫,૦૦૦/- સુધીની અને અનાવર્તક ખર્ચની રૂ.૫૦,૦૦૦/- સુધીની નાણાંકીય દરખાસ્તો (કમ-૧૬ સિવાય)
૧૮. મકાન માલિક પાસેથી ખર્ચ દેવાનું ન હોય તેવા પ્રસંગોએ વિભાગની અથવા નિયંત્રણ ફેઠળની કચેરીઓએ ભાડે રાખેલ કે સીધા સંપાદન કરેલા મકાનોના નાણાંકીય ખર્ચમાં રૂ.૨૫,૦૦૦/- સુધી મરામત અને સુધારા કરવાની દરખાસ્ત.
૧૯. મકાનો સરકારી કચેરીઓ માટે પુરેપુરા / અંશતઃ ઉપયોગમાં લેવાતા હોય ત્યારે સરકારના ફેતુ માટે સરકારી મકાનની અપ્રાપ્યતા અંગેના કાર્યપાલક ઇજનેરના પ્રમાણપત્રને તથા નાણાંકીય સત્તા નાણાંકીય સત્તા સોંપણીના નિયમોને અધીન રહીને વિભાગ અથવા તાબાની કચેરી માટે મકાન રાખવા બાબત.
૨૦. રાજ્યપત્રિત અધિકારીઓનું ચાર્જ એલાઉન્સ મંજૂર કરવું.
૨૧. રૂ.૧૦,૦૦૦/- સુધીનું ડેમરેજ ખર્ચ મંજૂર કરવા બાબત.
૨૨. રૂ.૨૫,૦૦૦/- સુધીની ડિમતના ડેડસ્ટોકના ઉપયોગમાં ન લઇ શકાય તેવી વસ્તુઓના વેચાણ અથવા અન્યથા નિકાલ કરવા બાબત.
૨૩. વિભાગ ફેઠળના ખાતાના વડાની કચેરીઓ માટે ડેડસ્ટોક વસ્તુઓ વ્યક્તિગત કિસ્સામાં રૂ.૫૦ હજારથી વધુ પરંતુ ૧ લાખ સુધી ખરીદી કરવા અંગે જરૂરી મંજૂરી આપવાના કેસો.
૨૪. સામાન્ય પ્રકારના તકેદારી સંદર્ભો
૨૫. ખાતાકીય / ભાષાકીય વગેરે પરીક્ષામાંથી નિયમોનુસાર મુક્તિ આપવા બાબત.
૨૬. પૂર્વ સેવા તાલીમમાં પરીક્ષાર્થીઓને નિયમોનુસાર પરીક્ષાની વધારાની તક આપવા બાબત.
૨૭. બિન રાજ્યપત્રિત કર્મચારીઓની નિમણૂક, બંદલી બઢતી, પ્રતિનિયુક્તિ, તાલીમ અને રજાઓ સહિતની મહેકમને લગતી તમામ બાબતો.
૨૮. વર્ગ-૨ના અધિકારીઓની નોકરી માટેની અરજી જાહેર સેવા આયોગને કે અન્યત્ર મોકલવા અંગેની બાબત. (સરકારની સ્થાયી સૂચનાઓને અધીન)

૨૬. વિભાગના વહીવટ નિયંત્રણ ફેઠળના ખાતાના વડાઓ/ કચેરીઓના વર્ગ-૨ના અધિકારીઓની ઇન સર્વિસ ટ્રેનીંગ.
૩૦. વિભાગના વહીવટ નિયંત્રણ ફેઠળના ખાતાના વડાની કચેરીઓમાં ફંગામી જગ્યાઓ ઉલ્લેખ કરવા અને તે જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
૩૧. વિભાગના વહીવટી નિયંત્રણ ફેઠળના વડાઓની કચેરીના વર્ગ-૧ના અધિકારીઓના ખાનગી અહેવાલ / વાષ્પિક મિલકત પત્રકોની જાજવણી.
૩૨. ફંગામી જગ્યાઓને કાયમી જગ્યાઓમાં ફેરવવા બાબત.



નીચેના પૈકી કોઈપણ બાબત અંગે નિર્ણય લેવાનો થતો હોય તો તેવા કેસનો

### નિકાલ ઉપ સચિવશ્રીએ કરવો

૧. લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાના પ્રશ્નો અંગે પ્રાથમિક જરૂરી માહિતી મંગાવતી યાદીઓ રવાના કરવા અને તેને લગતી સામાન્ય આનુષાંગિક બાબતો.
૨. મંત્રીશ્રીએ કોઈ નોંધ ન કરી હોય તેવી મંત્રીશ્રીને ઉદ્દેશીને કરાયેલ અરજુઓ અને પ્રચલિત નીતિ તેમજ પૂર્વ કિસ્સાના દાખલાને આધારે નિકાલ થઈ શકે તેવા પ્રકારની અરજુઓ.
૩. મુદતબહારની માંગણીઓ (ટાઇમ બાર્ડ કલેમ્સ) અંગેની દરખાસ્તો.
૪. મુદતી પત્રકો અને અન્ય પરચૂરણ બાબતો.
૫. લેખનસામગ્રીની વસ્તુઓ અને ફોર્મ પુરા પાડવા માટે મુદ્રણ અને લેખન સામગ્રીના નિયમ સંગ્રહના પરિશીષ્ટ-૩ અને ૧૫માં અધિકારીઓના નામોનો સમાવેશ કરવો.
૬. સચિવાલયના વહીવટી નિયંત્રણ ફેઠળની કચેરીઓમાં સાધન સામગ્રી (ડેસ્ટોક) અને પુસ્તકો વગેરે ખરીદવા તેમજ ભાડે લેવાની મંજૂરી.
૭. ફિસાબોનું મેળવણું.
૮. વિભાગના તાબા હેઠળના ખાતા / કચેરીના વાહનોના અકસ્માતમાં વળતર ચુકવણી.
૯. સચિવાલયમાં વહીવટી વિભાગોના ઉપસચિવશ્રીઓને સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણા વિભાગ તરફથી વહીવટી / નાણાકીય સત્તાઓ આપેલી હોય તે બધી બાબતો.
૧૦. નવા નિમાયેલ બિનરાજ્યપત્રિત કર્મચારીઓની તબીબી તપાસ, તેમના પૂર્વ છત્યાસ અને ચાલ ચલગત અંગે તપાસ કરવા બાબત.
૧૧. જોઇન્નિંગ ટાઇમ મંજૂર કરવા બાબત.
૧૨. ગૌણ વિધાન સમિતિને મોકલવાની રાબેતા મુજબની માહિતી.
૧૩. વર્ગ-૩, ૪ ના કર્મચારીઓની અન્યત્ર નોકરી માટેની અરજુઓ રવાના કરવી.
૧૪. બિન રાજ્યપત્રિત કર્મચારીઓના પગાર બાંધણી, પેન્શન, પગાર ભથ્થાના બાકી દાવાની ચૂકવણી અને અન્ય સામાન્ય પ્રકારની બાબતો.
૧૫. વહીવટ સામેની ફરીયાદો.

૧૬. બિન રાજ્યપત્રિત કર્મચારીઓને સામાન્ય નિયમો અનુસાર ખાતાકીય પરીક્ષા હિન્દી .  
પરીક્ષાઓ તથા પ્રાદેશિક ભાષાને લગતી પરીક્ષાઓમાં બેસવા દેવાની પરવાનગી આપવી.  
તથા તેવી અન્ય બાબતો.
૧૭. બિન રાજ્યપત્રિત કર્મચારીઓને ઉચ્ચ અભ્યાસની પરવાનગી.
૧૮. બિન રાજ્યપત્રિત કર્મચારીઓ સામેની શિસ્ત અંગેની રોજિંદા પ્રકારની બાબતો.
૧૯. બિન રાજ્યપત્રિત કર્મચારીને કાનુની સહાયના કેસો.
૨૦. બિન રાજ્યપત્રિત કર્મચારીઓ પાસેથી જામીનગીરી લેવા અંગે.